

## જાહેરાત

ગુજરાત શહેરી આજીવિકા મિશન  
જી.એમ.એફ.બી. બિલ્ડીંગ, સેક્ટર-૧૦/એ,  
ગાંધીનગર - ૩૮૨૦૧૦  
ફોન નં - ૨૯૭ ૫૦૨૮૩

રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન ની કામગીરી માટે ગુજરાત શહેરી આજીવિકા મિશન ની રચના કરવામાં આવેલ છે. અને મિશન હેઠળના સ્ટેટ મિશન મેનેજમેન્ટ યુનિટ ખાતે નીચે જણાવેલ કરાર આધારિત જગ્યા માટે યોગ્ય લાયકાત તથા અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

SMMU ખાતે ની જગ્યાઓની તથા જરૂરી શૈક્ષણિક લાયકાત તથા અનુભવ ની વિગત.

Sr. No	Name of post	No Of Post	Education and Experience Particulars	Maximum Age Limit
1	State Mission Manager–HR & Capacity Building	1	Two year fulltime Postgraduate diploma in Management/MBA or Masters in any other relevant discipline with minimum 55% along with 5 years of experience Or Graduate with minimum 55% from government recognized institutes with 8years of experience in staff recruitment, training and capacity building work with state level projects <b>Competencies</b> The person should have, in addition to the above Mentioned competencies, acknowledged capabilities in client management; excellent negotiation skills; ability to handle large scale recruitment; developing a theme based capacity building strategy and modules, Working Knowledge of Gujarati & English language etc.	up to 45 yrs

### સામાન્ય સુચનાઓ

- ૧) સદરહું ભરતી સબંધીત તમામ સુચનાઓ / વિગતો વખતો વખત website: [www.gulm.in](http://www.gulm.in) પરથી જોવા મળી શકશે.
- ૨) વિગતવાર જાહેરાત website: [www.gulm.in](http://www.gulm.in) પર ઉપલબ્ધ છે, રસ ધરાવતાં ઉમેદવારોએ તેમની અરજી રજીસ્ટર પોસ્ટ, સ્પીડ પોસ્ટ તથા કુરીયર દ્વારા ડેપ્યુટી મિશન ડાયરેક્ટર, ગુજરાત શહેરી આજીવિકા મિશન, જી.એમ.એફ.બી. બિલ્ડીંગ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર-૩૮૨૦૧૦ ના સરનામે નિયત થયેલ અરજી ફોરમેટ માં તા. ૨૧/૦૮/૨૦૧૭ સુધીમાં કચેરી સમય દરમ્યાન મોકલી આપવાની રહેશે. એપ્લિકેશન માટે કવર પર State Mission Manager–HR & Capacity Building ની પોસ્ટ માટે અરજી" લખવાનું ફરજિયાત રહેશે.
- ૩) ઉમેદવારની અગ્રીમતા યુનિર્વસીટી / સંસ્થાની Rating, ટેકનીકલ લાયકાત અને અનુભવના આધારે નક્કી કરવામાં આવશે. જેનું weightage પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે.

- ૪) ઉમેદવારે નિયત અરજીપત્રકમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે, અને તેના પુરાવાઓ (અસલ અને પ્રમાણિત નકલ) આ મિશન દ્વારા જ્યારે માંગવામાં આવે ત્યારે જે તે સ્થળે અને સમયે સ્વ-ખર્ચે રૂબરૂ રજૂ કરવાના રહેશે.
- ૫) શોર્ટલિસ્ટેડ થયેલ ઉમેદવારોને ઇ-મેલ દ્વારા ઇન્ટરવ્યુ માટે જાણ કરવામાં આવશે.
- ૬) ઉમેદવારોએ ઇન્ટરવ્યુ સમયે અસલ અને પ્રમાણિત જન્મ પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો તથા અન્ય પ્રમાણપત્રો સાથે હાજર થવાનું રહેશે.
- ૭) આ ભરતી પ્રક્રિયા અંગેનો આખરી નિર્ણય પસંદગી સમિતિ નો રહેશે.
- ૮) ઉંમર - તા. ૩૧/૭/૨૦૧૭ ના રોજ ૪૫ વર્ષથી ઓછી હોય તેવા જ ઉમેદવારો અરજી કરી શકશે.
- ૯) આ જગ્યાઓ પર પસંદગી પામેલ ઉમેદવારને તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર માં નિમણૂક આપવામાં આવશે.
- ૧૦) આ ભરતી પ્રક્રિયામાં આખરી પસંદગી પામેલ ઉમેદવારની નિમણૂક સત્તાધિકારી ઠરાવે તે શરતો ને આધીન નિમણૂક મેળવવાને પાત્ર ઠરશે. નિમણૂક પામેલ ઉમેદવારે મિશન સાથે કરાર કરવો પડશે, અને બોન્ડ આપવાનો રહેશે.
- ૧૧) ઉમેદવારનું માસિક ફીક્સ વેતન રૂ. ૪૫,૦૦૦/- (અંકે રૂપિયા પીસ્તાલીસ હજાર પુરા) રહેશે તેમ છતાં આ ફિક્સ વેતનમાં વધારો કે ઘટાડો કરવાની આખરી સત્તા રાજ્ય શહેરી આજીવિકા મિશનની રહેશે.
- ૧૨) અનુભવ મેળવેલ હોય તે પ્રત્યેક પ્રમાણપત્ર માં હોદ્દો, મળતો પગાર, અનુભવનો સમયગાળો દર્શાવેલ હોવો જોઈશે. અનુભવ જગ્યાને અનુરૂપ છે કે કેમ તે અંગે પસંદગી સમિતિનો નિર્ણય આખરી ગણાશે. નિયત શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કર્યા બાદનો જ અનુભવ ધ્યાને લેવામાં આવશે. પાર્ટ ટાઈમ કે આંશિક અનુભવ માન્ય રહેશે નહીં.
- ૧૩) ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
- ૧૪) ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી ભાષા નું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
- ૧૫) અરજીપત્રક ભરતા પહેલા વેબસાઈટ પર મુકવામાં આવેલ સુચનાઓ કાળજી પૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે, અને ત્યારબાદ જ અરજીપત્રક ભરવું.
- ૧૬) ઉમેદવારે અરજીપત્રકમાં બતાવેલ કોઈપણ વિગત અને ઉમેદવારે નિમણૂક સત્તાધિકારી સમક્ષ રજૂ કરેલ શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરેને લગતા પ્રમાણપત્રો અથવા વિગતો ભવિષ્યમાં જે તે તબક્કે નિમણૂક અધિકારી દ્વારા ખોટા માલુમ પડશે તો તેની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આવા ઉમેદવારોની નિમણૂક સત્તાધિકારી / સમિતિના પરામર્શના આધારે રદ કરવામાં આવશે. તેમજ ઉમેદવારને ગેરલાયક ઠરાવવામાં આવશે.
- ૧૭) ઉમેદવારે અરજીપત્ર પર પોતાનો તાજેતર નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો લગાવવાનો રહેશે અને સહી કરવાની રહેશે.
- ૧૮) ઉમેદવારે અરજી પત્રક સાથે પોતાની શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય વગેરેના પ્રમાણપત્રો ની પ્રમાણિત નકલ જોડવાની રહેશે.
- ૧૯) અધુરી વિગતો વાળી / નિયત પ્રમાણપત્રો ન જોડેલ અરજી રદ ગણવામાં આવશે.

૨૦) આ જાહેરાત કોઈપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો, તેમ કરવાનો મિશનને સંપૂર્ણ હક્ક / અધિકાર રહેશે, અને આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.

તા. ૦૨/૦૮/૨૦૧૭  
સ્થળ - ગાંધીનગર

સહી/-  
(એચ.બી. બ્રહ્મભટ્ટ)  
ડેપ્યુટી મિશન ડાયરેક્ટર  
ગુજરાત શહેરી આજીવિકા મિશન